



તેમની સાથે ઓનલાઈન ગુનાખોરી થઈ. કોઈનો મોબાઈલ ફોન હેક થાય છે તો કોઈની સાથે કંઈ સામાન લે-વેચના બહાને છેતરપિંડી થાય છે.

આજકાલ તો ડિજિટલ એરેસ્ટના કિસ્સા પણ વધતાં જાય છે. ઓછા ટેકનોસેવી અને વધારે ધનવાન હોય એવા લોકો ડિજિટલ એરેસ્ટનો વધુ ભોગ બને છે. હેક્સ આવા યુઝર્સનો ઓનલાઈન ડેટાબેઝ તૈયાર કરે છે. તેના આધારે અમુક ચોક્કસ લોકોને અલગ તારવે છે. એમાં તેઓ અમુક બાબતોનું ધ્યાન રાખે છે. ઉદાહરણ તરીકે, એ વ્યક્તિ સીનિયર સિટિઝન હોય અથવા તો તેમને એકથી વધુ બિઝનેસ-ધંધા હોય. સરકારી નોકરી હોય. આવા કિસ્સામાં તેમને ટેક્સના નામે કે બીજી કોઈ રીતે ધમકી આપવાનું સરળ બને છે. તેમને રેપ્રુટેશનની ચિંતા હોય છે એટલે જો સરકારી એજન્સીના અધિકારીના નામે તેમના નંબર પર ફોન જાય તો તેમના હાંજા ગગડી જાય છે.

આ પરિસ્થિતિ સ્કેમર્સને માફક આવી જાય છે. સ્કેમર્સ તેમને આ રીતે ફસાવે છે અને પછી જો પૈસા મેળવવામાં સફળતા મળે તો બેંક અકાઉન્ટ સફાઈ કરી નાખે છે. જ્યાં સુધીમાં એવો અંદાજ આવે કે આ ફોડ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં તો એ મળે એટલી રકમ મેળવીને રફુચકર થઈ જાય છે.

તદુપરાંત, બેંકના OTP મેળવીને એમાંથી ટ્રાન્ઝેક્શન કરીને કે પછી ATM, ક્રેડિટ કાર્ડના પીન નંબર મેળવીને પણ સ્કેમ થાય છે. તમને કોઈ લાખો-કરોડોની લોટરી લાગી છે અને એ તમારા સુધી પહોંચાડવા માટે અમુક પ્રોસેસિંગ ફીની જરૂર પડશે એટલે અમુક અમાઉન્ટ ટ્રાન્સફર કરો તો આગળની પ્રોસેસ કરી શકીએ એમ કહીને પણ છેતરપિંડી થાય છે.

આવી અને આ પ્રકારની બીજી અનેક ઓનલાઈન છેતરપિંડીના કારણે વ્યક્તિગત રીતે તો જેની સાથે છેતરપિંડી થાય છે એને નુકસાન થાય છે પરંતુ

સાઈબર ફ્રોડથી દુનિયાને વર્ષે 10.5 ટ્રિલિયન ડોલરનું નુકસાન

આના કારણે આખી દુનિયાને અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે.

તમે વિચારો કે ભારતના

અર્થતંત્ર કરતાં દોઢ ગણી રકમ

આવી છેતરપિંડીમાં જતી

હોય તો એ કેટલો મોટો

આંકડો થયો? સાઈબર

સિક્યોરિટી વેન્ચર્સ

નામની એક

સંસ્થા છે.

એ સાઈબર

કાર્ડમ પર

નજર રાખે

છે અને

તેનો રિપોર્ટ

તૈયાર કરે

છે. ઓનલાઈન

છેતરપિંડીનો ચોક્કસ

આંકડો તો ઉપલબ્ધ ન

બને એટલે સરકારી

ચોપડે જે નોંધાયા

હોય એવા આંકડાને

ધ્યાનમાં રાખીને આ

સંસ્થાએ તાજેતરમાં

અહેવાલ આપ્યો.

એ મુજબ

દુનિયાને

દર વર્ષે

ઓનલાઈન

છેતરપિંડી અથવા તો જેને આપણે સાઈબર કાર્ડમ

કહીએ છીએ એનાથી 10.5 ટ્રિલિયન ડોલરનો

ખામિયાજો ભોગવવો પડે છે. દુનિયાના

ટોપ-5 ઈકોનોમીના સંદર્ભમાં

આની સરખામણીએ કરીએ તો

અમેરિકાની ઈકોનોમી 28થી

30 ટ્રિલિયન

ડોલર છે.

બીજા ક્રમે

ચીનની

ઈકોનોમી

19

ટ્રિલિયન

ડોલર છે.

ત્રીજા ક્રમે જર્મની

છે. જ્યાંની ઈકોનોમી

4.7 ટ્રિલિયન ડોલર

છે અને એ પછી ભારત

અને જાપાન લગભગ 4.1

ટ્રિલિયન ડોલર સાથે ચોથા-

પાંચમા ક્રમે રહે છે. હવે તમે

વિચારો કે જર્મની-ભારત-

જાપાનના અર્થતંત્ર જેટલું

નુકસાન તો માત્ર સાઈબર

કાર્ડમથી જ થઈ જાય

છે. આટલી રકમ

હેક્સના હાથમાં ન

પહોંચતી હોય તો

એનાથી દુનિયાની

સબ હેડિંગ - તમે વિચારો કે ભારતના અર્થતંત્ર કરતાં દોઢ ગણી રકમ આવી છેતરપિંડીમાં જતી હોય તો એ કેટલો મોટો આંકડો થયો? દુનિયામાં દરરોજ એવરેજ 2200 સાઈબર કાર્ડમના બનાવો બને છે

સુખાકારીમાં કેટલો વધારો થતો હોત એ વિચારવા જેવું છે.

દુનિયામાં દરરોજ એવરેજ 2200 સાઈબર કાર્ડમના બનાવો બને છે. 24 કલાકમાં જો આટલા લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા હોય તો એ ફીગર બહુ મોટો કહેવો પડે. એક કલાકમાં સરેરાશ 80-90 લોકો પાસેથી હેક્સ રકમ ચાઉ કરી જાય છે.

સાઈબર કાર્ડમની આવી પરિસ્થિતિ સામે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. જાગૃત નહીં થઈએ તો એ હેક્સના હિતમાં છે. જાગૃતિ એ આપણા હિતમાં છે. ફેક નંબરમાંથી ફોન આવે કે ઓનલાઈન લે-વેચમાં કોઈ ગરબ દેખાય તો સત્વરે ચેતી જવું હિતાવહ છે. જો આપણને એ બાબતમાં ખબર ન પડતી હોય તો જેમને ખબર પડતી હોય એની સલાહ લો. કોઈ લલચામણી જાહેરાત પર ભરોસો ન મૂકો. એજન્સીના અધિકારીઓના નામે કોઈનો ફોન આવે તો એમનું લોકેશન જાણવાની કોશિશ કરો. નાહકના ગભરાયા વગર એનો સામનો કરો. તમારી સાવધાનીથી હેક્સના હાથમાં જતાં કરોડો રૂપિયા અટકશે.